

19 એપ્રિલ 2018

**ઓન્ટારિયો સરકારે ડાઉનટાઉન બ્રેમ્પટનમાં નવા રાયરસન યુનિવર્સિટીનાં કેમ્પસ**

**માટે લીલી ઝંડી આપી**

*શૈક્ષણિક ભાગીદાર તરીકે સામેલ છે શેરિડાન કૉલેજ, પરિવર્તન પ્રજ્વલિત કરતી પરિયોજના*

બ્રેમ્પટન, ઓન્ટારિયો – શહેરનું પરિવર્તન કરશે તેવા નોંધપાત્ર શિક્ષણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની જાહેરાતની ઉજવણી કરવા માટે આજે થયેલ બ્રેમ્પટન બોર્ડ ઓફ ટ્રેડના પ્રસંગે બ્રેમ્પટન અને GTHAની આસપાસના રાજકીય અને વ્યાપારી અગ્રણીઓ ભેગા મળ્યા હતાં. માનનીય મિટ્ટિઝ હન્ટર, ઉચ્ચ શિક્ષણ અને કૌશલ્ય વિકાસ મંત્રી (મિનિસ્ટર ઓફ એડવાન્સ્ડ એડ્યુકેશન એન્ડ સ્કલ્સ ડેવેલપમેન્ટ), માનનીય હરિન્દર માલ્હી, MPP બ્રેમ્પટન-સિંગરોડેલ અને મહિલાઓની સ્થિતિના મંત્રી (મિનિસ્ટર ઓફ સ્ટેટસ ઓફ વિમેન) સાથે મળી શૈક્ષણિક ભાગીદાર તરીકે શેરિડાન કૉલેજની સાથે નવા રાયરસન યુનિવર્સિટીનાં કેમ્પસની સ્થાપના થયાની જાહેરાત કરી હતી.

2022ના પાનખરમાં વર્ગ પ્રારંભ થવાનું પ્રસ્તાવિત છે ત્યારે નવું કેમ્પસ વિદ્યાર્થીઓને ડેટા-ડ્રિવન વિજ્ઞાન અને વ્યાપારના પ્રોગ્રામિંગ પૂરું પાડવા પર ફોકસ કરાશે જેની સાથે અનુભવલક્ષી કેળવણી જોડી દેવાશે. યોજનાઓમાં સામેલ છે નવું કેમ્પસ, સાયબરસિક્યોરિટી માટેના રાષ્ટ્રીય કેન્દ્ર (નૅશનલ સેન્ટર ફોર સાયબરસિક્યોરિટી) માટેની ભાગીદારી, અને એક ઈનોવેશન માટેનું કેન્દ્ર – જે એક સંયુક્ત ઉપયોગની સુવિધા હશે જેમાં સમાવેશ થશે સાર્વજનિક અને શૈક્ષણિક પુસ્તકાલયો અને ઈનોવેશન ઝોન. નવું કેમ્પસ ડાઉનટાઉન GO સ્ટેશનની બાજુમાં બાંધવામાં આવશે. સેન્ટર ઓફ ઈનોવેશન હાલના નેલસન સ્ક્વેર પાર્કિંગ જગ્યાને વિંટળાયેલ જમીન પર સ્થિત હશે.

“આ તો બ્રેમ્પટન માટે બે ત્રણ દાયકામાં એકાદ વખત આવતી તક છે, અને બે અગ્રણી સંસ્થાઓ સાથે ભાગીદારી કરવામાં અમને આનંદ ન થાય તો જ નવાઈ – રાયરસન યુનિવર્સિટી અને શેરિડાન કૉલેજ – જેમની સાથે મળી ડાઉનટાઉન બ્રેમ્પટનમાં નવું કેમ્પસ અને ઈનોવેશન સેન્ટર લાવી રહ્યા છીએ,” એવું બ્રેમ્પટનના મેયર લિન્ડા જેફ્રીએ જણાવ્યું હતું. “આજની જોરદાર જાહેરાત બ્રેમ્પટનના પરિવર્તનની અને આપણા નાગરિકો માટે નવી તકોની શુભ શરૂઆત ગણી શકાય. બ્રેમ્પટનને કેળવણી અને ઈનોવેશનનું ગંતવ્યસ્થળ બનાવવા માટે રાયરસન અને શેરિડાન સાથે ઉત્કૃષ્ટ ભાગીદારી ચાલુ રાખવા માટે અમે ઉત્સુક છીએ.”

બ્રેમ્પટનમાં નવી વિદ્યાપીઠ લાવવી તે સીટી માટે એક અગત્યની અગ્રતા હતી. સપ્ટેમ્બર 2017માં બ્રેમ્પટન સીટી કાઉન્સિલ દ્વારા નવી વિદ્યાપીઠ અને સેન્ટર ફોર ઈનોવેશન માટે \$150 મિલિયન સુધીની માતબર રકમની ઐતિહાસિક પ્રતિબદ્ધતા જાહેર કરવામાં આવી હતી.

સીટી ઓફ બ્રેમ્પટને ભાગીદારો, સમુદાયિક જૂથો અને વ્યાપારો સાથે વિતેલ વર્ષમાં સક્રિયપણે વ્યવહાર કર્યો છે જેથી ભવિષ્યની સફળતા માટે પાયો નાંખવામાં મદદ મળે. આ સફળતામાં નિમિત્ત બન્યા છે બ્લુ રિબન પેનલના કાર્યો, જેની સ્થાપના કાઉન્સિલ દ્વારા બ્રેમ્પટનમાં યુનિવર્સિટી કેમ્પસ લાવવા માટે સૂચનો પૂરા પાડવા માટે કરવામાં આવી હતી. 2017માં, સીટીએ એક આર્થિક પ્રભાવ અભ્યાસ સોંપ્યો હતો

જેમાં નવી યુનિવર્સિટી અને સેન્ટર ફોર ઇનોવેશનના આર્થિક અને સામાજિક લાભોના વૈવિધ્ય પર પ્રકાશ ફેંકવામાં આવ્યો. સીટી તેના ભાગીદારો સાથે સેન્ટર ફોર ઇનોવેશન માટે એક વિઝનના વિકાસ માટે પણ કાર્ય કરી રહ્યું છે, અને હાલમાં આ સુવિધા માટે સ્થાપત્યવિષયક (આર્કિટેક્ચરલ) સેવા મેળવવા સક્રિય વિનંતી કરવામાં આવી ચુકી છે.

"સીટી ઓફ બ્રમ્પટન માટે યુનિવર્સિટીની પહેલના પ્રોજેક્ટ મેનેજર પૉલ અલ્ડુનેટ (Paul Aldunate)નું કહેવું છે કે "અમે રાયરસન અને શેરિડાન સાથે સશક્ત ભાગીદારી ઊભી કરી છે" "અમે આ ઉત્તેજક પ્રોજેક્ટમાં સાથે મળીને આગળ વધવા ઉત્સુક છીએ જે બ્રમ્પટન અને તેના નાગરિકો માટે નોંધપાત્ર આર્થિક અને સાંસ્કૃતિક લાભ આણશે. આ પ્રોજેક્ટ આવતીકાલના કુશળ કાર્યબળનો વિકાસ અહીં ઘરઆંગણે ડાઉનટાઉન બ્રમ્પટનમાં જ કરી આપશે."

આઈકોનિક એટલેકે પ્રતિમાત્મક ડાઉનટાઉન ટોરોન્ટો કૅમ્પસની બહાર રાયરસનના શૈક્ષણિક પ્રોગ્રામિંગનું આ સહુપ્રથમ વિસ્તરણ છે. રાયરસનની નામના એક શહેર-ઊભું કરનારી સંસ્થા તરીકેની છે અને વિશ્વભરમાં તેના વ્યાપાર-કેન્દ્રિત ઇનોવેશન ઝોન માટે ઓળખાય છે. કારકિર્દીલક્ષી શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરીને રાયરસન ઉપલબ્ધ જગ્યાઓને ધ્યાનમાં લેતા ઓન્ટારિયોની કોઈ પણ યુનિવર્સિટી કરતા સૌથી વધુ અરજીઓ પ્રાપ્ત કરે છે.

રાયરસન યુનિવર્સિટીના ઉપ-કુલપતિ અને અધ્યક્ષ ડૉ. મોહમદ લઇએમીએ જણાવ્યું હતું કે "બ્રમ્પટનમાં વિસ્તરીને રાયરસન અતિ-આવશ્યક એવા યુનિવર્સિટીના પ્રોગ્રામ્સ, વિદ્યાર્થીઓને ફેનેડાના સૌથી વધુ ઝડપથી વૃદ્ધિ પામતા અને સૌથી વધુ વૈવિધ્ય ધરાવતા સમુદાયોમાં પૂરા પાડશે. "અમે ઉત્સુક છીએ કે શેરિડાન સાથે કાર્ય કરીને પ્રદેશના વિદ્યાર્થીઓને એવા નવીનતમ શૈક્ષણિક પ્રોગ્રામ્સ પૂરા પાડીએ જે આજના અદ્યતન અર્થતંત્રમાં સમૃદ્ધ થવા અને સફળતા મેળવવા માટે જરૂરી સૂક્ષ્મ દૃષ્ટિસહ ચિંતન અને સમસ્યાઓ ઉકેલવાના કૌશલ્યો આપી શકે."

બ્રમ્પટનમાં શેરિડાન લાંબો ઇતિહાસ ધરાવે છે તેમજ અગ્રેસર પ્રોગ્રામિંગના વિકાસ અને તેની રજૂઆતનો સશક્ત ટ્રેક રેકોર્ડ ધરાવે છે. પહેલેથી જ બ્રમ્પટનમાં ડેવિસ કૅમ્પસ અને સેન્ટર ઓફ એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ એન્ડ ડિઝાઇન ટેકનોલોજીનું ઘર બની ચુક્યું છે. શેરિડાને એપ્વાઈડ રિસર્ચ અને અનુભવલક્ષી કેળવણીમાં નામના મેળવી છે અને તેમનો સીટી ઓફ બ્રમ્પટનમાં અને તેની સાથે ભાગીદારીઓ ઊભી કરવાનો સશક્ત ઇતિહાસ છે.

"શેરિડાનના અધ્યક્ષ અને ઉપ-કુલપતિ ડૉ. મેરી પ્રીસ (Dr. Mary Preece) જણાવે છે કે "આ ઉત્તેજનાભર્યા સાહસમાં શેરિડાન રાયરસન યુનિવર્સિટી સાથે ભાગીદારી કરવામાં ખૂબ જ ગૌરવ અનુભવે છે. "50 વર્ષથી, અમે બ્રમ્પટનને ગર્વપૂર્વક અમારું ઘર માનીએ છીએ. આજના દિને એક નવા યુગની શરૂઆત થઈ છે. સર્જનાત્મક રીતે સમસ્યા નિવારણ શીખવવાની શેરિડાનની તાકાત પર અમે પાયો બાંધીએ છીએ, જે ઇનોવેશન પરના મનોમંથન માટેના અમારી બન્ને સંસ્થાઓના પ્રસ્થાપિત ટ્રેક રેકોર્ડ અને અમારા બન્નેના અનુભવલક્ષી કેળવણીના મૂલ્યો પર આધારિત છે. બન્ને સાથે મળીને અમે વિદ્યાર્થીઓને આજના જમાનાને અનુરૂપ શિક્ષણ મેળવવામાં હજુ વધુ તકો પૂરી પાડીશું.

### હકિકતોનો ટૂંકસાર

- પ્રોજેક્ટની શૈક્ષણિક શરૂઆત તારીખ સપ્ટેમ્બર 2022 હશે એવી આશા રાખવામાં આવે છે.
- નવા બ્રમ્પટનના કૅમ્પસમાં રાયરસન 2,000 વિદ્યાર્થીઓની ભરતી કરવાનું આયોજન ધરાવે છે.

- સીટી ઓફ બ્રમ્પટન દ્વારા 10 વર્ષ સુધી યુનિવર્સિટી સુવિધા માટે \$50 મિલિયન અને સેન્ટર ફોર ઇનોવેશન માટે \$100 મિલિયન સુધીની રકમની પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી છે.
- સીટી ઓફ બ્રમ્પટન અને ઓન્ટારિયો પ્રાંત વચ્ચે આશરે બિલિયન ડોલરના ચોથા ભાગ જેટલી રકમ નવી યુનિવર્સિટી અને સેન્ટર ફોર ઇનોવેશન માટે અર્પિત છે.
- 2017માં, સીટીએ એક આર્થિક પ્રભાવ અભ્યાસ સોંપ્યો હતો જેમાં નિદર્શિત કરવામાં આવ્યું કે નવી યુનિવર્સિટી અને સેન્ટર ફોર ઇનોવેશનના બાંધકામ અને વાર્ષિક પ્રચલન હજારો નોકરીઓ અને સેંકડો મિલિયન ડોલરની આર્થિક પ્રવૃત્તિ લાવશે.
- ડાઉનટાઉન બ્રમ્પટનનું સ્થાન ટ્રાન્ઝિટ દ્વારા સરળતાથી પહોંચી શકાય તેવું છે, જે GO ટ્રાન્ઝિટ મારફત GTA અને ઇનોવેશન સૂપર કોરિડોર સાથે જોડે છે, અને વ્યાપાર અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ પ્રજ્વલિત કરશે જેનાથી સર્જશે એક નમૂનારૂપ બ્રમ્પટન ડેસ્ટિનેશન.
- ડાઉનટાઉન બ્રમ્પટન યુનિવર્સિટી લોકેશન બ્રમ્પટનની ટોરોન્ટો-વોટરલૂ ઇનોવેશન કોરિડોરનાં કેન્દ્રમાં પદોન્નતિ કરે છે, જે પ્રતિભા, કેળવણીકારો, રોકાણકારો, સાહસિકો અને ઉચ્ચ વૃદ્ધિ ધરાવતી પેઢીઓને જોડતી ઇકોસિસ્ટમ છે.

-30-

**બ્રમ્પટન વિશાળ આયોજનો વિષે વિચારે છે.** અમે તીક્ષ્ણ ફોકસ ધરાવતું ભવિષ્ય માટે તૈયાર સંગઠન છીએ. અમે જાણીએ છીએ કે આપણા સમુદાયની વૃદ્ધિ, યુવાની અને વૈવિધ્ય આપણને અલગ ઓળખ પ્રદાન કરે છે. અમે કેનેડાના ઇનોવેશન સૂપર કોરિડોર ખાતે સ્થિત છીએ જ્યાં રોકાણોને પ્રોત્સાહિત કરીએ છીએ અને વૈશ્વિક સ્તરે અમારી સફળતામાં વૃદ્ધિ કરી રહ્યા છીએ. અમે બનાવી રહ્યા છીએ એવા ગતિશીલ શહેરી કેન્દ્રો જે તકોનો તાણખો યાંપે છે અને અહીં કામ કરતા લોકોમાં ગૌરવની લાગણીનો સંચાર કરે છે. અમે બ્રમ્પટનને આગળ ધપાવી રહ્યા છીએ જેથી તે એક જોડાણ ધરાવતું શહેર બને જે પ્રવર્તનાત્મક, વ્યાપક અને સાહસિક હોય. અમને [Twitter](#) અને [Facebook](#) પર ફોલો કરો. અહીં વધુ જાણકારી મેળવો [www.brampton.ca](http://www.brampton.ca).

**મિડિયા સંપર્ક (MEDIA CONTACT):**

નેટલી સ્ટોગિલ (Natalie Stogdill)

મિડિયા સંકલનકર્તા (Media Coordinator)

સીટી ઓફ બ્રમ્પટન

905.874.3654 | [natalie.stogdill@brampton.ca](mailto:natalie.stogdill@brampton.ca)